

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૯/૨૦૧૭ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી અને જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૯૬૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૮ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૪૦૧ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૦૮ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૪,૬૪૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૬૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૯૬૮/૧૭

સેટેલાઇટ : રૂચીર ગૌતમભાઈ પાઠક (રહે,કર્મજ્યોત-૨, પ્રેરણાતીર્થ દેરાસર સામે, સેટેલાઇટ) એ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૯/૧૭ રાતના ૯/૩૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘર નજીક પોતાની ઇનોવા કાર નંબર જીજે.૦૧.આર.જે.૧૨૫૨ કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જેની ચોરી તા.૨૮/૦૯/૧૭ બપોરના ૩/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.કે.રાઠોડ ચલાવે છે.

શાહીબાગ : રાકેશકુમાર શાંતીલાલ શાહ (રહે, નળકુંજ સોસાયટી, શાહીબાગ) એ તા.૨૮/૯/૧૭ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૦૯/૧૭ રાતના ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘર નજીક પોતાની સેટ્રો કાર નંબર જીજે.૦૧.એચ.એમ.૫૯૬ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જેની ચોરી તા.૨૭/૦૯/૧૭ ના કલાક ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એ.પટેલ ચલાવે છે.

કરંટ લાગતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૯૬૯/૧૭

ગુજરાત યુનિવર્સિટી : કિશ સ/ઓ રાકેશભાઈ ગોરીયા (ઉ.વ.૦૮)(રહે,વાલ્મીકીવાસ મ્યુનિદવાખાના સામે, લાલ બંગલા, સી.જી.રોડ, નવરંગપુરા) તા.૨૭/૦૯/૧૭ રાતના ૧૦/૩૦ વાગ્યાનાં સુમારે નવરંગપુરા પાંચ બંગલા, સરકારી વસાહતમાં ખુલ્લા મેદાનમાં ગરબા ફરતે લગાવેલ લોખંડની જાળીએથી કિશને કરંટ લાગતા, સારવાર માટે તેને વા.સા.હોસ્પિટલ લાવતા રાતનાં ૧૧/૦૦ વાગે ફરજ પરના ડૉ.શ્રી એ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી બી.કે.ગૌસ્વામી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૯૭૦/૧૭

શહેરકોટડા : કુસુમબેન નટવરલાલ ખોડાભાઈ ગોહેલ (ઉ.વ.૫૯)(રહે,અશોકમીલની જુની ચાલી અનિલ સ્ટાર્ચ મીલની સામે અનિલ રોડ) એ પોતાની બીમારીથી કંટાળી જઈ તા.૨૮/૦૯/૨૦૧૭ ના કલાક ૧૦/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પોતાની જાતે પોતાના ઘરનાં બાથરૂમમાં પોતાની જાત ઉપર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી વાલસિગભાઈ મલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.